

નોટિસ

બી. એસસી. સેમ-1 એડમિશન બાબત

નોવેલ કોરોના વાયરસને (COVID-19) WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ પરિસ્થિતિ ને ધ્યાને લઈ વિદ્યાર્થીઓને તેમના એડમિશનની કામગીરી માટે પોતાના ગામ/શહેરથી કોલેજ સુધી મુસાફરી ન કરવી પડે અને કોરોના વાયરસ ના ચેપ લાગવાની સંભાવનાઓથી બચાવી શકાય તે આશયથી આ કોલેજ દ્વારા બી.એ./બી. એસસી.ના વિદ્યાર્થીઓના એડમિશન ફોર્મની પ્રક્રિયા કોલેજની વેબસાઈટ પર ઓનલાઈન માધ્યમથી જ કરવામાં આવેલી. ત્યારબાદ આ વેબસાઈટ પર બી. એસસી. સેમ-1 નું મેરીટ તા.30/06/2020 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ. આ મેરીટમાં જે પણ વિદ્યાર્થીઓના નામ આવેલ છે તેવા તમામ વિદ્યાર્થીઓએ નીચે આપેલી લિન્ક પર પોતાના ડોક્યુમેન્ટને તા.30/07/2020 (11:00 AM) થી તા. 03/08/2020 (5:00 PM) દરમિયાન અપલોડ કરવાના રહેશે. અપલોડ થયેલા આ ડોક્યુમેન્ટને કોલેજ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જેમના ડોક્યુમેન્ટ verify થયા હશે તેમણે પોતાની એડમિશન/સત્ર ફી આગામી દિવસે કોલેજ વેબસાઈટ પર online ભરવાની રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન માધ્યમથી થતી હોય, દરેક વિદ્યાર્થી/વાલીએ પોતાના ડોક્યુમેન્ટને સંપૂર્ણપણે ચકાસ્યા બાદ જ અપલોડ કરવા. શક્ય હોય તો દરેક ડોક્યુમેન્ટને નામ આપી ત્યારબાદ અપલોડ કરી શકાય જેથી ભૂલ થવાની સંભાવના ન રહે.

સત્ર ફી ની વિગત: ભાઈઓ: રૂ. 1200/- બહેનો: રૂ. 600/-

ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની લીંક:

<https://mpsasc.edu.in/verify-documents>

ખાસ નોંધ:

જો વિદ્યાર્થી દ્વારા નિયત સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરવામાં આવે, ફોર્મ ભરતી વખતે આપેલ માહિતી કરતાં અન્ય માહિતી દર્શાવતા અથવા ખોટા કે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવશે તો આવા સંજોગોમાં તે વિદ્યાર્થીનો પ્રવેશ માટે નો દાવો રદ થશે અને આ અંગે અન્ય કોઈપણ પ્રકારની ફરિયાદ ધ્યાને નહીં લેવામાં આવે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અપલોડ કરવાનાં ડોક્યુમેન્ટનું લિસ્ટ

- 1) પાસપોર્ટ સાઈઝનો ફોટો.
- 2) ધોરણ-૧૨ની માર્કશીટ
- 3) ધોરણ-૧૨ની ટ્રાયલ સર્ટિફિકેટ
- 4) સક્ષમ અધિકારીનું જાતિ અંગેનો સર્ટિફિકેટ.(લાગુ પડતા તમામ કેટેગરી માટે)
- 5) સક્ષમ અધિકારીનું નોન-ક્રિમીલીયર સર્ટિફિકેટ. (માત્ર ઓ.બી.સી. વિદ્યાર્થીઓ માટે)
- 6) EWS કેટેગરીના વિદ્યાર્થીઓએ પણ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- 7) જો શારીરિક ખોડ-ખાંપણ હોય તો સક્ષમ અધિકારીનું તે અંગેનો પ્રમાણપત્ર.(૪૦% કે તેથી વધુ)
- 8) ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સિવાયના બોર્ડ જેવા કે CBSE, કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલયમાંથી પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ સૌ.યુનિવર્સિટીનું કામચલાઉ એલીજબીલીટી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે, ત્યારબાદ એક મહિનામાં ફાઈનલ એલીજબીલીટી પ્રમાણપત્ર આપવાનું રહેશે. અન્યથા પ્રવેશ રદ થશે.

નોંધ:

દરેક ડોક્યુમેન્ટ .jpg અથવા .png ફોર્મેટમાં અપલોડ કરવાનાં રહેશે જેમની મહત્તમ સાઈઝ 1MB રાખવાની રહેશે. પાસપોર્ટ સાઈઝના ફોટાની સાઈઝ 50KB થી વધારે નાં થવી જોઈએ.